

NW London

# kd. know diabetes

## સ્વાસ્થ્યપ્રદ ખોરાક

તમે ડાયબિટીસ સાથે જીવી રહ્યા હो કે નહિ, ખાવા અને પીવા પરત્વે સ્વાસ્થ્યપ્રદ, સુસંતુલિત અભિગમ અગત્યનો છે. તમે જે ખોરાક ખાવો પસંદ કરો તે માત્ર તમારા ડાયબિટીસનું નિયમન કરવામાં જ મદદ નહિ કરે, પરંતુ વજનના નિયમન અને વ્યાય રોગ, સ્ટ્રોક અને અમૃક કેન્સર જીવી લાંબા ગાળાની સ્થિતિઓના જોખમને ઓછું કરવામાં પણ મદદ કરશે.

તમે આહાર પ્રત્યે સંતુલિત અભિગમ અપનાવીને, તમારા વજનને નિયંત્રિત કરીને અને સક્રિય રહ્યો તેનાથી તમારા ડાયબિટીસનું નિયમન કરવામાં મદદ મળી શકે છે. અહીં જે માહિતીની રૂપરેખા આપી છે તે તમારા ડાયબિટીસના નિયમનમાં મદદ માટે ખોરાકની સ્વાસ્થ્યપ્રદ પસંદગીઓ કરવામાં તમને મદદ કરશે.

## ડાયબિટીસમાં સ્વાસ્થ્યપ્રદ ખોરાક માટેની ટિપ્પણી

### 1. નિયમિત ભોજન

મહત્વનો સંદેશ: રોજ ત્રણ વખતના ભોજનનો ધ્યેય રાખો અને ભોજન છોડી દેવાનું ટાળો.

જે તે દિવસનો આહાર સવારના નાસ્તા, બપોરના ભોજન અને સાંજના ભોજન પર આધારિત હોવો જોઈએ. આનું પાલન કરવાથી લોહીમાં ગલુકોઝ સ્થિર રાખવામાં, શક્તિનાં સ્તરો પૂરતાં રાખવામાં મદદ મળશે અને વરચ્યે વરચ્યે નાસ્તો ખાવાની ઈચ્છા ટાળવામાં મદદ મળશે.

### 2. ખાંડયુક્ત કાર્બોહિદ્રેટો

મહત્વનો સંદેશ: ઉપરથી ઉમેરેલ (મુક્ત) ખાંડને દિવસ દીઠ 30 ગ્રામ સુધી મર્યાદિત રાખો.

ડાયબિટીસ હોવાનો અર્થ એ નથી કે તમારે ખાંડ બિલકુલ બંધ કરી દેવી પડો. તરકીબ એ છે કે ખોરાક પ્રત્યે સમગ્રપણે સંતુલિત અભિગમ અપનાવવાના, ખાંડયુક્ત ખોરાકને મર્યાદિત કરવાના અને ક્યારેક ક્યારેક પીણાં લેવાના ભાગઢુપે નાના પ્રમાણમાં તેનો આનંદ લેવો.

### 3. સ્ટાર્ચ્યુક્ત કાર્બોહિદ્રેટો

**મહત્વનો સંદર્ભ:** દરેક મુખ્ય ભોજન વખતે સ્ટાર્ચ્યુક્ટ કાર્બોઓદિનનો સમાવેશ કરો, જેમાં ફ્રાઇબર અને આખું અનાજ વધારે હોય એવા વિકલ્પો પસંદ કરો જે ઓછો ગ્લાયસેમિક આંક ધરાવતા હોય.

સ્ટાર્ચ્યુક્ટ કાર્બોઓદિનો સ્વાસ્થ્યપ્રદ ખોરાક હોવા છતાં તેનાથી લોહીમાં ગ્લુકોઝનાં સ્તરો પર અસર પડશે. કાર્બોઓદિનનો ભાગ જેટલો મોટો, લોહીમાં ગ્લુકોઝનાં સ્તરો એટલાં વધારે રહેશે. એથી ઊંઘણું, જો તમે ઓછું પ્રમાણ લો તો તમારા લોહીમાં ગ્લુકોઝનાં સ્તરો પર અસર ઓઈ પડશે. વધુ પ્રમાણમાં ફ્રાઇબર અને આખું અનાજ ધરાવતા અને ઓછો ગ્લાયસેમિક આંક ધરાવતા સ્ટાર્ચ્યુક્ટ કાર્બોઓદિનો પસંદ કરવાથી તમારા લોહીમાં ગ્લુકોઝનાં સ્તરો પર ઓઈ અસર પડી શકે છે, કારણ કે તેમનું પાચન ધીમેથી થાય છે. તેનાથી તમને લાંબો સમય માટે પેટ ભરાયેલું પણ લાગી શકે છે, તેથી તેનાથી વજન ઓછું કરવામાં પણ મદદ મળી શકે છે.

#### 4. ફળો અને શાકભાજી.

**મહત્વનો સંદર્ભ:** દિવસમાં ફળો અને શાકભાજીનાં ઓછામાં ઓછા પાંચ પિરસણો લેવાનું ધોય રાખો.

ફળો અને શાકભાજી એ ફ્રાઇબરનો ઉત્તમ સ્રોત છે અને આવશ્યક અને વિટામિનો તથા ખનીજતત્વોથી ભરપૂર હોય છે. વૈવિધ્યસમ્બર ખોરાક લેવો અને રોજ ઓછામાં ઓછા પાંચ પિરસણો લેવાથી તમને ઉચ્ચ રક્તદાબ, હદ્યરોગ, સ્ટ્રોક, સ્થૂળતા અને અમુક કેન્સરો જેવી સ્વાસ્થ્યની ધાર્ણી સ્થિતિઓ થવાનું જોખમ ઘટાડવામાં મદદ મળી શકે છે. વધારાનો લાભ એ છે કે તેમાં કુદરતી રીતે શક્કિન (ક્લેરી) ઓઈ અને ફ્રાઇબર વધારે હોવાથી તે તંદુરસ્ત વજન જાળવી રાખવામાં મદદ કરી શકે છે. જન્યુસમાં તાજ, ફોઝન, સૂકવેલા, ઉભાબંધ ફળો અને પાણીમાં ઉભાબંધ શાકભાજીઓ, કોઈ વધારાનાં ખાંડ અને મીઠું ઉમરેલાં ન હોય તે સૌની ગાળું થાય છે.

#### 5. મીઠું

**મહત્વનો સંદર્ભ:** રોજ 6 ગ્રામથી વધારે મીઠું ન લો તેનું ધ્યાન રાખો.

વધુપડતું મીઠું લેવાથી તમારો રક્તદાબ વર્ધી શકે છે, ઝકાસ કરીને જો તમે સ્થૂળ હો અથવા જો ઉચ્ચ રક્તદાબ તમારા કુટુંબમાં વારસાગત ચાલ્યો આવતો હોય. આ ચિંતાજનક છે, કારણ કે ઉચ્ચ રક્તદાબથી કોરોનરી હદ્ય રોગ થવાના જોખમમાં વધારો થાય છે.

#### 6. આલ્કોહોલ

**મહત્વનો સંદર્ભ:** દર અઠવાડિયે 14 યુનિટથી વધારે પીશો નહિ, અને ધાણા દિવસો આલ્કોહોલ વિનાના જવા જોઈએ.

ભલામણું કરેલા પ્રમાણ કરતાં તમે સતત વધારે પ્રમાણમાં આલ્કોહોલ પીઓ તો રક્તદાબમાં વધારો અને અમુક કેન્સર સહિતની ધાર્ણી બિમારીઓ થવાના જોખમમાં વધારો થાય છે. ડાયનિટીસ હોવાનો અર્થ એ નથી કે તમારે આલ્કોહોલ

પીવાનું ટાળવું જોઈએ. હકીકતમાં, તમને ડાયબિટીસ હોય કે ન હોય, પ્રમાણભાન સાથે પીવા માટેની સરકારી માર્ગદર્શિકાઓ એક જ છે.

## 7. ઓમેગા 3 ફ્લેટી ઓસિડ્સ

મહત્વનો સંદેશ: દર અઠવાડિએ તૈલી માઇલીનાં બે પિરસણો ઉમેરવાનું ધ્યેય.

ઓમેગા 3 ફ્લેટ એ આવશ્યક ફ્લેટી ઓસિડ્સ છે જે શરીરમાં પૂરતા પ્રમાણમાં બનાવી શકતા નથી. તે લોહીમાં ટ્રાયાલિસરાઈડ્સ (લોહીમાં જોવા મળતી એક પ્રકારની ચરબી) ઘટાડી શકે છે અને હદ્ય રોગ સામે રક્ષાણ આપવામાં મદદ કરી શકે છે.

## 8. ચરબી

મહત્વનો સંદેશ: સંતૃપ્ત ચરબીને સ્થાને સમકક્ષ અસંતૃપ્ત ચરબી બર્દને ચરબીનું કુલ પ્રમાણ ઘટાડવાનું ધ્યેય રાખો.

તંદુરસ્ત વજન પ્રાપ્ત કરવા અથવા જાળવવા માટે ચરબીનું કુલ પ્રમાણ ઘટાડવું જરૂરી છે. મધ્યમ પ્રમાણમાં મોનોઅનસેચ્યુરેટેડ ફ્લેટ્સ (ઓલિવ અને રેપસીડ ઓર્ઝલ અને સ્પ્રેડ્જ) અને પોલિઅનસેચ્યુરેટેડ ફ્લેટ્સ (સોયા, સનક્લાવર અને કોર્ન ઓર્ઝલ તથા સ્પ્રેડ્જ; નટ્સ, સીડ્જ, તૈલી માઇલી)ને સ્થાને સંતૃપ્ત ચરબીને સ્થાન આપવાથી હદ્યના સ્વાસ્થ્ય પર લાભદારી અસર થઈ શકે છે. યાદ રહે કે વજન ઓછું કરવામાં મદદ માટે કુલ લેવામાં આવેલી ચરબીનું પ્રમાણ ઓછું કરવું જરૂરી છે.

## 9. પિરસણનાં કદ

મહત્વનો સંદેશ: જો તમે વજન ઓછું કરવાનો પ્રયત્ન કરી રહ્યા હો તો તમારે તમારાં પિરસણો ઘટાડવાની જરૂર પડી શકે છે જે માટે વિવિધ પ્રકારના આહાર સમૂહોની વચ્ચે સમગ્રપણે યોગ્ય સંતુલન સાધવું જોઈએ.

યુક્તમાં દર ત્રણ પુઅત વ્યક્તિમાંથી લગભગ બે વ્યક્તિઓ સ્થૂળ કે વધુપડતું વજન ધરાવતી હોય છે. જેમને ડાયબિટીસ હોય એવી વ્યક્તિઓ માટે, વજનમાં વધારાને કારણે ઈન્સ્યુલિન પ્રત્યેનો અવરોધ વધતો હોવાનું જોવા મળ્યું છે (જેનો અર્થ એ છે કે તમારા શરીર જે રીતે ઈન્સ્યુલિનનો ઉપયોગ કરવો જોઈએ તે રીતે તે કરી શકતું નથી). આનાથી ગલાયસેમિક (લોહીમાં ગલુકોજ) અંકુશ વણસનો હોવાનું અને ડાયબિટીસ આગળ વધરવાનું જોખમ વધતું હોવાનું જોવા મળ્યું છે.

## 10. ડાયબિટીસ સાથે સંબંધિત ઉત્પાદો

મહત્વનો સંદર્ભ: ડાયબિટીસ સાથે સંબંધિત ઉત્પાદો લેવાં હિતાવહ નથી.

આ પ્રકારના ખોરાકથી કોઈ લાભ થતો નથી, કેલરી અને ચરબી વધારે હોઈ શકે છે, મૌંધા હોય છે, તેની રેચક અસર થઈ શકે છે અને તે લીધા પછી પણ લોહીમાં ગલુકોઝનાં સ્તરો પર અસર થઈ શકે છે.

ઇટવેલ પ્લેટ એ રોજ વિવિધ આહાર સમૂહોના આહાર કેટલા પ્રમાણમાં લેવા જોઈએ તે માટેની ખરેખર ઉપયોગી માર્ગદર્શિકા છે.

એકલદોકલ આહાર સમૂહો વિશેની વધુ ચોક્કસ માહિતી નીચેનાં પાનાઓ પર જોઈ શકાશે:

- કાર્બોહિટો
- ચરબી
- ફળો અને શાકભાજી
- ફોઠિબર અને આખાં અનાજ
- માંસ, માઇલી અને દાળ
- ઉશી

[Diabetes UK Enjoy Food](#) એ તમને તમારી આહારની આદતોમાં સુધારો લાવવામાં માર્ગદર્શન આપતું અગત્યનું સંસાધન છે:

- ભોજન વિષયક વિચારો માટે [અહીં ક્લિક કરો](#)
- ભોજન વિષયક આયોજનો માટે [અહીં ક્લિક કરો](#)